https://archive.org/details/bk931/page/n0/mode/1up

2017-10-08 -Umiya Mataji Unjha -Final Judgement (931)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

વા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી, ઊંઝા.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના

સનાતન અને સતપંથના વિવાદ અંગે

નિમાયેલ લવાદનો નિર્ણય

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાએ વિશ્વના કડવા પાટીદારોની સર્વોચ્ચ અને અંગત માલિકીની એકમાત્ર ધાર્મિક સંસ્થા છે તેથી પાટીદાર સમાજના હિતોનું રક્ષણ કરવાનું, સમાજમાં સંપ-સહકાર-સંગઠન-ભાવાત્મક એકતા-ભાઈચારો અને મા ઉમિયા પ્રત્યેનો ભક્તિભાવ વધે તે માટેના પ્રયાસો કરે છે. આ સંસ્થા દ્વારા સમાજમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે. આ સંસ્થાનો પારદર્શક અને વિકાસલક્ષી અભિગમ હોવાથી આ સંસ્થાનું સમાજમાં આગવું સ્થાન છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

realpatidar.com

https://archive.org/details/bk931/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk931/page/n2/mode/1up

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

realpatidar.com

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના
સનાતન અને સતપંથના વિવાદ અંગે
નિમાયેલ લવાદનો નિર્ણય

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાએ વિશ્વના કડવા પાટીદારોની સર્વોચ્ચ અને અંગત માલિકીની એકમાત્ર ધાર્મિક સંસ્થા છે તેથી પાટીદાર સમાજના હિતોનું રક્ષણ કરવાનું, સમાજમાં સંપ-સહકાર-સંગઠન-ભાવાત્મક એકતા-ભાઈચારો અને મા ઉમિયા પ્રત્યેનો ભકિતભાવ વધે તે માટેના પ્રયાસો કરે છે. આ સંસ્થા દ્વારા સમાજમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે. આ સંસ્થાનો પારદર્શક અને વિકાસલક્ષી અભિગમ હોવાથી આ સંસ્થાનું સમાજમાં આગવું સ્થાન છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

realpatidar.com

https://archive.org/details/bk931/page/n3/mode/1up

2017-10-08 -Umiya Mataji Unjha -Final Judgement (931)

realpatidar.com

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં વર્ષોથી ચાલતા સનાતન અને સતપંથ ના જે વિવાદ ચાલે છે તે માટે આ બન્ને સંસ્થાઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાને લવાદગીરી સોંપી છે જે બન્ને પક્ષોએ લવાદગીરી સ્વીકારી છે. બન્ને સંસ્થાઓ સનાતન સમાજે **તા. ૧૫-૦૯-૨૦૧૫** અને સતપંથ સમાજે **તા. ૨૮-૦૯-૨૦૧૫** ના રોજ પોતાની સંસ્થાના લેટર પેડ ઉપર લખી સંસ્થાઓના જવાબદાર ૧૧-૧૧ પ્રતિનિધિઓના નામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝામાં રજુ કર્યા હતા. તે અંતર્ગત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની વાર્ષિક જનરલ સભા તેમજ કારોબારી સભામાં અવાર-નવાર તેમના વિવાદો અંગે રજુઆતો કરવામાં આવેલ તેમજ બન્ને પક્ષના આગેવાનોએ રૂબરૂ અને ટેલીફોન દ્વારા આ વિવાદના ઉકેલ માટે રજુઆતો કરેલ તે અનુસંધાને આ બન્ને સંસ્થાના પ્રતિનિધિઓને અનેકવાર માતાજી સંસ્થાનમાં શાંતિથી સાંભળ્યા. બન્ને પક્ષ તરફથી ખુલાસા-પ્રતિ ખુલાસાઓ કરવામાં આવ્યા બન્ને પક્ષ સાથે અવાર-નવાર મિટીંગો કરીને સાંભળવામાં આવ્યા. આમ ખૂબ જ ઊંડાણ પૂર્વક બન્ને પક્ષોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. મા ઉમિયાએ અમને જે સુઝાડયુ તેવી સુઝબુઝથી નીચેના નિર્ણય આપીએ છીએ. જે બન્ને પક્ષોએ અમલ કરવાનો રહેશે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk931/page/n4/mode/1up

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No. : A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

realpatidar.com

૩

(૧) સતપંથ અને સનાતન પંથ શબ્દોને કારણે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ વિભાજીત સ્થિતિમાં છે જેને કારણે સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થયેલ છે. જેથી સનાતન અને સતપંથ ને સમરસ કરવાની અત્યંત જરૂરીયાત છે. કચ્છ સમાજના સનાતન અને સતપંથના ભાઈ-બહેનો મા ઉમિયાના સંતાનો હોવાથી હવે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ તરીકે ઓળખવાનો છે. હવેથી સતપંથ અને સનાતન પંથ શબ્દોનો પ્રયોગ કરવાનો રહેશે નહિ અને તે પ્રમાણે સમગ્ર સમાજે સામાજિક વ્યવહાર કરવાનો છે.

(૨) ઈમામશાહ શબ્દ મુસ્લીમ (ઈસ્લામધર્મ) સાથે જોડાયેલો છે જેથી મુસ્લીમ (ઈસ્લામધર્મ) ના કોઈપણ ક્રિયાકર્મો-વિધિ વિધાન સતપંથ સમાજે કરવી યોગ્ય નથી. કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથમાં માનવાવાળાઓએ સંપૂર્ણ પણે હિન્દુ ધર્મના ઈશ્વર તથા ઈશ્વરના અવતારો તથા દેવી-દેવતાઓ વગેરેનું પૂજન કરવું તથા હિન્દુ ધર્મના શાસ્ત્રોનું વાંચન તેમજ તેના પ્રવચનોમાં ભાગ લેવો જોઈએ. જેથી સતપંથ અને સનાતન સંપ્રદાયે સમરસ થઈ સાથે મળીને હિન્દુ ધર્મની ઓળખ ઊભી કરવાની છે. તેથી સમગ્ર સમાજ હિન્દુ કડવા પાટીદાર તરીકે ઓળખતો કરવાનો છે.

(૩) પીરાણાપંથની જે સંસ્થા છે તે સંસ્થામાં કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથમાં માનનારા વર્ષોથી પોતાની આવકના ૧૦ % ફાળો આપે છે જેથી આ સંસ્થાનો સંપૂર્ણ વહીવટ હિન્દુ સનાતન ધર્મ મુજબ આપણા સમાજ પાસે એટલે કે કચ્છ કડવા પાટીદાર સમાજ પાસે રહે તે ખાસ જરૂરી છે. જેથી આ ફંડ આપણા સમાજના વિકાસ માટે વાપરી શકાય.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

realpatidar.com

https://archive.org/details/bk931/page/n5/mode/1up

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

realpatidar.com
Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી, ઊંઝા.

(૪) ઘણા સમયથી બન્ને પક્ષે વ્યકિતગત સામાજિક કે અન્ય સંસ્થાઓમાં એકબીજા સામે કોર્ટ કચેરીમાં જે કેસો કરવામાં આવ્યા છે તે આજ તારીખથી **૬૦** દિવસ સુધીમાં કેસો સંપૂર્ણપણે પાછા ખેંચી લેવા જેથી બન્ને પક્ષે સદભાવ અને પ્રેમ જળવાઈ રહેશે.

(૫) કચ્છ કડવા પાટીદાર સમાજમાં બહેન દિકરીઓ અને સગા વ્હાલાઓ એકબીજાના ઘરે જાય નહિ તેવા જુદા-જુદા ઠરાવો થયેલ છે તે રદ કરવા અને બહેન દિકરીઓ, ભાઈઓ અને સગા વ્હાલાઓમાં બહિષ્કારનું વાતાવરણ ઉભુ થયેલ છે તે નાબુદ કરી સમાજમાં ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ ઊભુ કરવું. જેથી કરીને સામાજિક સંગઠનોને સમરસ કરી શકાય.

(૬) અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં આપણા પૂર્વજોએ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓની સ્થાપના કરેલી તે વખતે બન્ને સંપ્રદાયોની સંયુકત મિલકતો અને સામાજિક સંબંધો હતા. તેમાં એમની સમજ એવી હતી કે સાથે રહેવાથી ધીરે ધીરે સતપંથમાં માનનારા સનાતન હિન્દુ ધર્મના પ્રવાહમાં ભળી જશે અને તેના પરિણામો પણ આવ્યા છે. હજુ પણ કેટલાક પ્રસંગો સાથે ઉજવવામાં આવે છે. તેથી સતપંથમાં માનનારા ભાઈ-બહેનો સમજપૂર્વક મોટા પ્રવાહમાં ભળી જાય તેવી મા ઉમિયાની ઈચ્છા છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા-૩૮૪૧૭૦. (ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

realpatidar.com

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી, ઊંઝા.

realpatidar.com

(૭) પિરાણા પંથ વિષ્ણુ ભગવાનના દસ અવતારોમાં દસમા અવતાર તરીકે નિષ્કલંકી નારાયણમાં માને છે. જે હિન્દુ ધર્મની માન્યતા વિરૂધ્ધ છે તેના બદલે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ વિષ્ણુ ભગવાનના દસમા અવતારમાં કલકી નારાયણ તરીકે અવતરવાના છે તે મુજબ તેની આરતી/પૂજા કરવી

આપણા હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અધ્યાય **૩** માં **૩૫** મા શ્લોકમાં નીચે પ્રમાણે કહ્યું છે.

श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् ।
स्वधर्मे निधन श्रेयः परधर्मो भयावहः ॥ ३५ ॥

સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે. પોતાના ધર્મમાં મરવું પણ કલ્યાણકારી છે અને અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. ॥ ૩૫ ॥

ઉપર મુજબના લવાદોના નિર્ણયની અમલવારી બન્ને પક્ષે સાથે મળી ભાઈચારાની ભાવનાથી સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજે કરવી, જયારે મિટીંગો, સંમેલનો કરવાની જરૂર પડે ત્યારે સમાજમાં પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ ઊભુ કરવા ઝુંબેશ ચલાવવાની છે જેમાં શ્રી ઉમિયા માતાજી સસ્થાન-ઊંઝા હંમેશા કચ્છ કડવા પાટીદાર સમાજની સાથે છે અને રહેશે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન
ઊંઝા-૩૮૪૧૭૦.
(ઉ.ગુજરાત)

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com • Email : umiyamatajiunjha@gmail.com • / www.facebook.com/umiyamatajiunjha

realpatidar.com

https://archive.org/details/bk931/page/n7/mode/1up

॥ श्री उमाम्बा शरणमस्तु जन्मान्तरेष्वपि ॥

Trust Regd. No.: A-943, Mehsana PAN : AAATK2933L

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા

Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha

realpatidar.com

૬

આ ચુકાદાના અમલીકરણ માટે સમાજમાં વધુમાં વધુ પ્રચાર થાય તે માટે સમાજની મિટીંગોમાં અને સમાજની માસિક પત્રિકાઓમાં છાપી પ્રચાર કરવો.

ઉપરોકત નિર્ણય નીચે જણાવેલ લવાદ કમિટીએ સર્વાનુમતે કરેલ છે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાની લવાદ કમિટી

૧. શ્રી નારાયણભાઈ લલ્લુદાસ પટેલ - ઊંઝા	પ્રમુખશ્રી
૨. શ્રી મણીભાઈ ઈશ્વરલાલ પટેલ - ઊંઝા	કન્વીનરશ્રી
૩. શ્રી દિલીપભાઈ મણીલાલ પટેલ - ઊંઝા	માનદમંત્રીશ્રી
૪. શ્રી વિક્રમભાઈ ધનજીદાસ પટેલ - ઊંઝા	સભ્યશ્રી
૫. શ્રી પ્રહલાદભાઈ જોઈતારામ પટેલ - મહેસાણા	સભ્યશ્રી
૬. શ્રી વસંતભાઈ નારાયણદાસ પટેલ - ઊંઝા	સભ્યશ્રી
૭. શ્રી બાબુભાઈ એચ. ધોડાસરા - રાજકોટ	સભ્યશ્રી
૮. શ્રી જયરામભાઈ ગોવિંદભાઈ વાંસજાળીયા - જામનગર	સભ્યશ્રી
૯. શ્રી જયંતિભાઈ કાલરીયા - રાજકોટ	સભ્યશ્રી
૧૦. શ્રી ગણેશભાઈ દ્વારકાદાસ પટેલ - સુરત	સભ્યશ્રી

(નારાયણભાઈ એલ. પટેલ)
પ્રમુખ
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા

સ્થળ :- ઊંઝા

તારીખ :- ૦૮-૧૦-૨૦૧૭

Unjha : 384170 (North-Guj.) India. Phone : Office : 02767 - 245472, 245972, Fax : 245772,
Guest House : 246474, Bhojanalay : 245474
Web : www.maaumiya.com ● Email : umiyamatajiunjha@gmail.com ● / www.facebook.com/umiyamatajiunjha

realpatidar.com